

July 18, 2024

To,

**BSE Limited** 

Dept. DSC CRD Phiroze Jeejeebhoy Towers,

Dalal Street

Mumbai 400 001

BSE Scrip Code: 506222

### **National Stock Exchange of India Limited**

Exchange Plaza,

Plot No. C/1, 'G' Block, Bandra- Kurla Complex,

Bandra ('E'), Mumbai 400 051

NSE Symbol: **STYRENIX** 

Sub: Intimation regarding publication of notice in newspapers as per MCA Circular No. 20/2020

dtd. May 5, 2020 read with circular dated December 28, 2022 and circular dated September

2023, with respect to convening of AGM through VC/OAVM and related matters.

Ref: Regulation 30 and Regulation 47 of Securities and Exchange Board of India (Listing

Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations')

Dear Sir/ Madam.

Referring to the above, please find enclosed copies of newspaper publications of the notice to the shareholders of the Company regarding the upcoming 51st Annual General Meeting (AGM) predispatch of the Annual Report 2023-24 published in following newspapers on July 18, 2024:

Newspaper	Language	Distribution Area	
Vadodara Samachar	Gujarati	Vadodara District	
Business Standard	English	Gujarat	

The above information is also available on the website of the Company www.styrenix.com.

This is for your records and further dissemination.

Thanking You,

Yours faithfully,

For Styrenix Performance Materials Limited

Chintan Doshi Manager – Legal & Company Secretary

Styrenix Performance Materials Limited

(formerly known as INEOS Styrolution India Ltd.)

9th Floor, 'SHIVA', Sarabhai Compound, Dr. Vikram Sarabhai Marg, Vadiwadi, Vadodara - 390 023.Gujarat, India.

+91 265-2303201/02

secshare@styrenix.com

www.styrenix.com

CIN: L25200GJ1973PLC002436



### Advertisement giving notice about registration under Part- I of Chapter XXI of the Act

Pursuant to Section 374(b) of the Companies Act, 2013 and rule 4(1) of the Companies Authorized to Register) Rule - 2014]

- . Notice is hereby given that in pursuance of sub-section (2) of section-366 of the Companies Act-2013, an application is proposed to be made to the Registrar at Ahmedabad that H3 PRE SCHOOL LLP, a LLP (LLPIN:AAP-1349) may be registered under Part I of chapter XXI of the Companies Act, 2013 as a Company limited by shares.
- The Principal objects of the Company are as follows: To carry on business to acquire, undertake, promote, run, manage, own, take on lease give on lease, franchise, take on franchise, give on franchise, to act as franchiser, convert open, operate, running Preschools, Providing academic, training & other administrative support to run Playgroup schools with Foundation Program, Day Care, Nursery, KG-1 (Junior KG), KG-2 (Senior KG) & run Activity Centre, running Tuition Classes, running teachers training centre with Certificate, Seminar for Parents and doing all such activity to flourish education among children, Providing different educational tools to small children Spreading Smart School Concepts among parents.
- . A copy of the draft Memorandum and Articles of Association of the proposed Company may be inspected at the office at A-313, Mondeal Heights, Nr. Panchratna Party Plot, S.G Highway, Ahmedabad, GJ 380051.
- Notice is hereby given that any person objecting to his application may communicate their objection in writing to the Registrar at Central Registration Centre (CRC), Indian Institute of Corporate Affairs (IICA), Plot No. 6,7,8 Sector 5, IMT, Manesar, Dist. : Gurgaon (Haryana), Pin Code -122 050, within twenty one days from the date of publication of this notice, with a copy to the Company at its registered office.

FOR, H3 PRE SCHOOL LLP SD/-

Dated this 12th July day of 2024

**Designated Partner** 



**Branch: Bombay Market**-Shop No G-1 A-C, Orchid Tower, Parvat Patia, Near APMC Market, Surat Kadodara Road, Surat- 395010 - PH. 0261-2355169 Email ID: b854@indianbank.co.in

(for Immovable property)[Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules, 2002] Whereas, The undersigned being the authorized officer of the Indian Bank under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interes Act and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 23.04.2024 calling upon the borrower/mortgagor Mrs. Hansaben Himmatbhai Thummar (Borrower & Mortgagor) & Mr. Manish Himmatbhai Thummar (Co-Borrower) to repay the amount mentioned in the notice being of Rs.16,27,293/-(Rupees Sixteen Lakhs Twenty Seven Thousand Two Hundred and Ninety Three only) and the said amount carries further interest also within 60 days from the date of receipt of the said notice. The borrower/mortgagor having failed to repay the amount, notice is hereby given to the

borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules, on this 16th day of July of the year 2024.

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, ir respect of time available, to redeem the secured assets. The borrower/mortgagor in particular and the public in general is hereby cautioned not to

deal with the property and any dealings with the property will be subject to the charge of the Indian Bank for an amount of Rs.16,27,293-plus interest and other charges thereon as on All that piece and parcel of the immovable property bearing Plot No.80, adm. 44.65 sq. Mtrs., together with undivided proportionate share adm. 36.93 sq. Mtrs. In road & COP, total

adm.81.58 in "Nilkanth Varni", Situated on the land bearing R.S. No.384/1, Block No.359 adm.18670 sq. Mtrs. of Village: Velanja, Taluka: Kamrej, Dist. Surat Standing In the name of Mrs. Hansaben Himmatbhai Thummar. **Boundaries are**: **East**: Wado of adj. property, West: Society Road, North: Plot No. 81, South: Block No. 79

Date: 16/07/2024 Place: Surat

Authorised Officer, Indian Bank, Bombay Market Branch, Surat

# यूनियन बैंक 🕠 Union Bank

Rajkot Main Branch: Bhabha Commercial Hub,

Opp. Gandhi Museum, Panchnath Road, Rajkot - 360 001 Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the authorised officer of Union Bank of India, Mi Satendra Kumar, Authorised Officer, Union Bank of India, Rajkot Main Branch Rajkot under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcemen Security Interest (Second) Act, 2002 (Act No. 54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement Rules, 2002 issued a Demand Notice Dated 22.11.2023 calling upon the Borrowers / Partners / Directors 1. M/s J K Traders (Borrower), 2. Mrs. Jayshree ben Rajendra Kotak (Proprietor & Mortgagor), 3. Estate of the deceased Mr. Karan Rajendra Kotal (Mortgagor & Guarantor) Represent by (A) Mrs. Gopikar Karan Kotak (Spouse), (B) Mr. Dhrivik Karan Kotak (Son), (C) Other to repay the amount mentioned in the notice being Rs. 55,79,632.53/- (Rupees Fifty Five Lakh Seventy Nine Thousand Six Hundred Thirty Two and Paise Fifty Three One) and further interest + charges thereon within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with rule 8 of the said rules on this 17th July 2024.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India for an amount Rs. 55,79,632.53/- (Rupees Fifty Five Lakh Seventy Nine Thousand Six Hundred Thirty Two and Paise Fifty Three One) and interest + charges

The Borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to the borrower to redeem the secured assets

### DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that Piece & Parcel of the Immovable Property being : Residential Flat having area admeasuring Square Meter 79.92, Square Feet 860.0 situated on the second floor of the Building situated on aghat land admeasuring Square Yards 150.00 of the City Survey No. 1697 paikee, City Survey Wards No. 14 of the area known as Jagnath Plot. Street No. 1/13 of Rajkot City in the State of Gujarat. **Bounded By:** 

North: Jagnath Plot, Street No. 13 Road South: Others Property Date: 17.07.2024, Place: Rajkot

East: Others Property Authorised Officer, Union Bank Of India

### PUBLIC NOTICE

Public Notice is hereby given to the general public that as per the Order of the Securities and Exchange Board of India in the matter of unregistered Investment Advisory activities by M/s 4W Wealth Management Pvt. Ltd. vide Order No.: QJA/GR/WRO/ WRO/30533/2024-25 read with Order No.: QJA/KS/WRO/WRO/ 29270/2023-24,any clients/ complainants/investors of the aforesaid firm who have paid the fees shall contact undernamed for the refund

Contact No.: +91- 9054064278 E-mail id: info4wwealth@gmail.com Address: 301/B, Polaris Mall,Puna

### Markets, **Insight Out**

Markets, Monday to Saturday

To book your copy, sms reachbs to **57575** or email order@bsmail.in



as per the brief particulars given hereunder;

**GICICI Bank** Branch Office: ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara- 390007.

PUBLIC NOTICE-TENDER CUM E-AUCTION FOR SALE OF SECURED ASSET

[See proviso to Rule 8(6)] Notice for sale of immovable asset(s)

E-Auction Sale Notice for the sale of immovable asset(s) under the Securitisation and Reconstruction of Financial (Enforcement) Rules, 2002. ternorcement) Rules, 2002. This notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable property mortgaged/ charged to the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of ICICI Bank Limited will be sold on 'As is where is', 'As is what is' and 'Whatever there is'

Sr. No.	Name of Borrower(s)/ Co-Borrowers/ Guarantors/ Loan Account No.	Details of the Secured asset(s) with known encumbrances, if any	Amount Outstanding	Reserve Price Earnest Money Deposit	Date and Time of Property Inspection	Date & Time of E-Auction
(A)	(B)	(C)	(D)	(E)	(F)	(G)
1.	(Borrower)/ Vasava	Plot No: 166, Vraj Villa, Opp. Indian Oil Petrol Pump, Valia Road, Mouje Kosmadi Tal, Ankleshwar, Dist Bharuch- 393003. Admeasuring Built up Area 455.74.5g. Et. Eree Hold Property.	for a section	Rs. 11,39,000/- Rs. 1,14,000/-	August 17, 2024 From 11:00 AM To 12:00 Noon	

The online auction will be conducted on the website https://disposalhub.com of our auction agency M/s NexXen Solutions Private Limited The Mortgagors/ Noticees are given a last chance to pay the total dues with further interest by August 27, 2024 before 04:00 PM else the secured asset(s) will be sold as per schedule.

U4:00 PM else the secured asset(s) will be sold as per schedule.

The prospective bidder(s) must submit the Earnest Money Deposit (EMD) Demand Draft (DD) (Refer Column E) at ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390007 on or before August 27, 2024 before 03:00 PM. Thereafter, they have to submit their offer through the website mentioned above on or before August 27, 2024 before 04:00 PM. along with the scanned image of the Bank acknowledged DD towards proof of payment of EMD. In case the prospective bidder(s) is/ are unable to submit his/ her/ their offer through the website, then the signed copy of tender documents may be submitted at at ICICI Bank Towers, Near Chakli Circle, Old Padra Road, Vadodara-390007 on or before August 27, 2024 before 05:00 PM. Earnest Money Deposit DD/PO should be from a Nationalised/ Scheduled Bank in favour of ICICI Bank Limited 'payable at Vadodara.

For any further clarifications in terms of inspection, Terms and Conditions of the E-Auction or submission of tenders, contact ICICI Bank Employee Phone No. 7304914237.

Please note that the Marketing agencies 1. M/s NexXen Solutions Private Limited 2. Augeo Asset Management Private Limited have have also been engaged for facilitating the sale of this property.
The Authorised Officer reserves the right to reject any or all the bids without furnishing any further reasons.

For detailed Terms and Conditions of the sale, please visit www.icicibank.com/n4p4s

Date : July 18, 2024 Place: Bharuch Authorized Officer **ICICI Bank Limited** 

### INTEGRA

### **INTEGRA ENGINEERING INDIA LIMITED**

CIN: L29199GJ1981PLC028741

ENGINEERING Regd. Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat.

Tel. No.: +91 90999 18471.

**Email ID**: info@integraengineering.in **Website**: www.integraengineering.in Statement of Unaudited Consolidated Financial Results for the Quarter ended 30th June, 2024

Sr. Quarter ended Quarter ended **Particulars** 30.06.2023 No 30.06.2024 Total income from operations 3,556.86 3,843.34 Net Profit / (Loss) for the period before Tax 422.14 597.22 417.64 Net Profit / (Loss) for the period after Tax 293.63 Total Comprehensive Income for the period 295.02 417.33 343.65 **Equity Share Capital** 343.65 6 Other Equity Earnings per share of ₹ 1/- each (1) Basic 0.85 1.21

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in) and on Stock Exchange website (www.bseindia.com).

Place: Mumbai Date: 17.07.2024

र्हे श्रे वैक ऑफ़ बड़ौदा

(2) Diluted

For INTEGRA Engineering India Limited Shalin Sunandan Divatia **Independent Director** 

Physical

as on 31/12/2022

1.21

### **RO JEWELS LIMITED** CIN: L74999GJ2018PLC105540

Registered Office: 707 Ador Asspire, Nr. Gulbai Tekra BRTS Bus Stop, University to Panjrapole Road, Ahmedabad, Gujarat, 380015 || Website: rojewels.co.in || Contact: 079-22144429 || Email: compliancerojewels@gmail.com

STATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS
FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2024 (Rs. in Lakhs)

					,	
Sr. No	Particulars	3 Months ended on <b>30-06-2024</b> Unaudited	3 Months ended on <b>31-03-2024</b> Audited	3 Months ended on <b>30-06-2023</b> Unaudited	Year ended on 31-03-2024 Audited	
		Ullaudited	Audited	Unaudited	Audited	
1	Total Income	638.50	5805.13	27283.64	36760.64	
2	Net Profit for the year before tax	4.99	-98.25	135.04	104.33	
3	Net Profit for the year after tax	3.79	-65.25	110.04	92.33	
4	Total Comprehensive Income for the year	3.79	-65.25	110.04	92.33	
5	Paid up Equity Share Capital	1008.93	1008.93	1008.93	1008.93	
6	Other Equity Excluding Revaluation Reserve	-	-	-	-	
7	Earnings per share (Face Value of Rs.2/- each)					
	Basic & Diluted	0.01	-0.13	0.22	0.18	
Not	Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the					

Notes: (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 17-07-2024 (b) The Audit is required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. (c) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quaerterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com) (d) The figures for the previous Quarters / periods are re-arranged / re-grouped, wherever considered necessary. For and on behalf of RO Jewels Ltd.

sd/- **Shubham Bharatbhai Shah**, Managing Director - DIN: 08300065



Date: July 17, 2024

Place: Vadodara

### STYRENIX PERFORMANCE MATERIALS LIMITED

(formerly known as INEOS Styrolution India Limited) CIN: L25200GJ1973PLC002436

Registered Office : 9th Floor, "Shiva", Sarabhai Complex Dr. Vikram Sarabhai Marg, Vadiwadi, Vadodara - 390023, Gujarat. Tel. No: +91 265 2303201 / 2303202 Email: secshare@styrenix.com | Website: www.styrenix.com

### 51<sup>ST</sup> ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM)

Shareholders of the Company may note that in compliance with General Circular Nos. 20/2020 and 10/2022 dated May 05, 2020, December 28, 2022 and 09/2023 dated September 25, 2023 respectively, and other circulars issued in this respect ("MCA Circulars") read with all other applicable circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI), the 51<sup>st</sup> Annual General Meeting (AGM) of the Company will be held through VIDEO CONFERENGING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM) on Wednesday, August 21, 2024 at 11.30a.m. IST, to transact the business as set out in the Notice of the Meeting.

- In compliance with the above circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2023-24 will be sent to all the shareholders whose email addresses are registered with the Company / Depository Participant(s).
- Shareholders holding shares in dematerialized mode and whose email ids are not registered are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depositary participants.
- Shareholders holding shares in physical mode are requested to either dematerialise their holdings or furnish relevant Investor Service Request Forms (ISR-1 and ISR-2) for registering their email addresses and mobile numbers and to update their bank details for receiving dividend, with the Company's Registrar and Share Transfer Agent, M/s. Link Intime India Private Limited. The above forms are available on the Company's website at www.styrenix.com and on RTA's website at hhttps://liiplweb.linkintime.co.in/ KYC-downloads.html
- Shareholders holding shares in dematerialized mode are requested to update their bank / ECS details, where applicable, for receiving dividend through their depository participants.

Shareholders will have an opportunity to cast their vote remotely prior to the AGM or during the AGM on the business as set forth in the Notice of the AGM, through electronic voting system. The manner of voting remotely prior to the AGM or during the AGM for shareholders holding shares in dematerialized mode, physical mode and for shareholders who have not registered their email addresses will be provided in the Notice to the shareholders.

The notice convening the 51st AGM and Annual Report 2023-24 will also be made available on the Company's website, at www.styrenix.com, the Stock Exchange websites at www.bseindia.com and www.nseindia.com and on the NSDL's website at www.evoting.nsdl.com.

Shareholders may please note that in terms of aforementioned circulars, the Company will not send physical copies of AGM Notice and Annual Report to the Shareholders.

For Styrenix Performance Materials Limited

**Chintan Doshi** 

Manager Legal and Company Secretary



Whereas The undersigned being the authorized officer of the Bank of Baroda, Kapodara Branch, Jay Complex, Upper Ground Floor, Opp. Hirabaug Circle, Kapodara, Varachha Main Road, Surat – 395006 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 26/06/2023 calling upon the borrower 1) Mr. Himmatbhai Jethabhai Dhankecha (Borrower) 2) Mr. Ronak Himmatbhai Dhankecha (Co-Borrower) 3) Mr. Kalpeshbhai Punabhai Malani (Guarantor) to repay the amount mentioned in the notice being Rs. 8,71,900.65/- (In Words Rupees Eight lakh Seventy One Thousand Nine Hundred and Sixty Five Paisa Only) is due to us as on 24/06/2023 with interest as mentioned in notice, within 60 days from the ate of receipt of the said Notice.

he Borrower/ Partners having failed to repay the amount, notice is hereby given POSSESSION of the property described herein below in exercise of powers conferred on her under Sub Section (4) of Section 13 of Act read with rule 8 of the Security Interest Enforcement Rules, 2002 in compliance of the order dated 13/05/2024 passed by the Honble Chief Judicial Magistrate, Kathor in CRMA No. 705/2024 under Sec. 14 of the said Act on this 17 day of July of the year

The borrower/Partners in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda** for an amount **Rs. 8,71,900.65/- (In Words** Rupees Eight lakh Seventy One Thousand Nine Hundred and Sixty Five Paisa Only) is due to us as on 24/06/2023 and further interest thereon plus other

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

### Description of the immovable property

All those places and parcel the immovable property i.e. Plot No. 203 (As per K.J.P. Block No. 213/B/203) admeasuring area 74.23 sq. mtrs. Along with undivided proportionate share admeasuring 45.26 sq.mtrs. in the roads and COP total admeasuring 119.49 sq. meters of "Nandini Residency Vibhag – 1" plotted in non-agricultural land admeasuring 28642 sq. meters of Revenue Block No. 213 of Village: Velanja, Taluka: Kamrej, District: Surat. Property in the name of Mr. Ronak Himmathhai Dhankecha Authorised Office Date: 17/07/2024 | Place: Kathor Bank of Baroda

### NOTICE

NOTICE is hereby given that the EXTRAORDINARY GENERAL MEETING of the Members or AJWA FUN WORLD AND RESORT LIMITED will be held on Friday, 09th Day of August, 2024 AT 04.00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the following business:

Approval for Sale/Disposal of land of the Company pursuant to the provisions or Section 180(1)(a) of the Companies Act, 2013 and Regulation 37A(1) of the Securities and Exchange Board of India (Listing Obligations And Disclosure Requirements) and Exchange Boa Regulations, 2015: sider and if thought fit, to pass the following Resolution as a Special Resolution

"RESOLVED THAT pursuant to the provisions of Section 180(1)(a) and other applicable PRESURED THAI pursuant to the provisions of Section 180(1)(a) and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("Act") read with Rules made thereunder (including any statutory modification or re-enactment thereof, for the time being in force), the enabling provisions of the Memorandum and Articles of Association of the Company and Regulation 37A(1) and other applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and subject to such other approvals, consents and permissions obtained/to be obtained from the appropriate third parties including concerned statutory authorities and subject to such terms and conditions as may be imposed by them, and which may be agreed to by the Board of Directors of the Company approval of the Members of the Company be and is hereby accorded to the Board of Directo of the Company (hereinafter referred as the "Board" which term shall be deemed to include of the Company (hereinafter referred as the "Board" which term shall be deemed to include any Committee which the Board may have constituted or hereinafter constitute from time to time to exercise its powers including the power conferred by this resolution), for effecting the sale, bifurcation, assignment, transfer and conveyance of the Property comprising of land owned by the company admeasuring 25,279 Sq Mtrsbearing CTS number NA 62 and land admeasuring 69,973 Sq Mtrs bearing CTS number NA 63 (P) situated at Village Rayantalawadi, Taluka Waghodia, District Baroda, India to G P Development Limited (hereinafter referred as the "Buyer") in one or more tranches/phases and either as a whole or in part for per square meter rate Rs. 5,968.37 and subject to such terms and conditions as mutually agreed upon p whe Company with the Ruyer utually agreed upon by the Company with the Buyer.

RESOLVED FURTHER THAT the Board be and is hereby authorized to do such further acts deeds and things as may be necessary including modifying, finalizing the terms and conditions and executing all such agreements, undertakings, contracts, deeds and other documents on behalf of the Company, file applications and make representation in respect thereof and seek approval from statutory / administrative authorities, financial institutions / banks etc., in this regard as may be applicable and deal with any matters, take necessary steps in this matter as the Board may in its absolute discretion deem necessary, desirable and expedient to give effect to this resolution and to settle any guestion / difficulty that may arise in this regard and incidental thereto, without being required to seek any further consen or approval of the Members or otherwise to the end and intent that the Members shall be emed to have given their approval thereto expressly by the authority of this resolution

RESOLVED FURTHER THAT the Board be and is hereby authorised to delegate all or any of the powers herein conferred, to any Committee of Directors or Director(s) / Manager / Chie Financial Officer & Chief Risk Officer / Company Secretary and/or any of the officers , uthorised representatives of the Company, with authorities as required, affixing th ommon Seal of the Company on agreement/documents, arranging delivery and executio of Contract, deeds, agreements and instruments." BY ORDER OF BOARD OF DIRECTORS For AJWA FUNWORLD AND RESORTS ITD

Date: 16-07-2024 Place : Vadodara

SD/-RAJESHKUMAR CHUNILAL JAIN Managing Director (DIN: 00285542)

Taluka-Veraval, Dist. Gir

### STATE BANK OF INDIA

Property u/s 13(4) of SARFAESI Act 2002 Stressed Assets Recovery Branch (SARB) (18735) 2nd Floor, Administrative Office Building, Nilambaug Chowk, Bhavnagar, Gujarat - 364 001, Phone: 0278-2514051, E-mail: sbi.18735@sbi.co.in

Notice is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (64 of 2002) and in exercise of powers conferred under section 13 (12) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, a demand notice was issued on the dates mentioned against each account and stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taken **Physical Possession** of the property described herein below in exercise of power conferred on him/her under section 13(4) of the said Act read with Rule 9 of the said Act on the dates mentioned against each account.

the Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the STATE BANK OF INDIA for an amount and interest thereon. The borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Name of Proprietor/ Name of Account/ Description of the property mortgaged/ charged ossession/ Type (as per demand notice) (in Rupess) & address Owner of property etc Smt Kanchan Babu Smt Kanchan Babu All that piece and parcel of Immoveable Propert Rs. 22.06.015.54 All that piece and parcel of Immoveable Property being Residential Property Plot No-42, situated on Survey no: 364 and 365 Southern Sides at Kamnath Society, Bhalpara, Taluka: Veraval, Dist: Gir Somnath, Gujarat surrounded by: North: Adj. Other's property of Plot No 42 paiki South: Adj. Property of Plot No.59/A, East: 6.10 Mts. Wide Road, West: Adj. Property of Plot No 41 ungi and Shri Babu Rupees Twenty Two Lacs Six Thousand ethalal Jungi Plot No 42 Kampath 13/07/2024 Fifteen and paisa Society, Bhalpara,

Date: 13.07.2024. Authorized Officer State Bank of India, SARB, Bhavnagar (18735)

**VIVID MERCANTILE LIMITED** CIN: L74110GJ1994PLC021483 dress: Basement, Medicare Centre, B/h. M.J. Library, Opp. Stock Exchange, Ellisbridge, Ahmedabad - 380006. Gujarat. || Website: www.vividmercantile.com || Contact: 079-48921375 || Email: complianceviel@gmail.com FATEMENT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS

FOR THE QUARTER ENDED ON 30TH JUNE, 2024 (Rs. in Lakhs) Particulars 3 Months 3 Months Year Unaudited Unaudited Audited Audited Total Income 584.65 480.82 2832.76 45.9 40.9 Net Profit for the year before tax 50.35 326.61 1493.74 Net Profit for the year after tax Total Comprehensive Income for the year 326.61 40.9 2279.76 Paid up Equity Share Capital
Other Equity Excluding Revaluation Reserve 1002.56 1002.56 1002.56 1002.56 Earnings per share (Face Value of Rs.10/- each) 3.26 12.94

Notes : (a) The above financial result were reviewed and recommended by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 17-07-2024 (b) The Audit is required under Regulation 33 of the SEB Listing Obligation and Disclosure Requirements Regulations, 2015 has been completed by Auditors of the company. Régulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quaerterly Financial Results are available on the websites of the Stock Exchange(s) and the listed entity. (www.bseindia.com (d) The figures for the previous Quarters / periods are re-arranged / re-grouped, wherever considered necessary. For Vivid Mercantile Limited

Place: Ahmedabad sd/- Satishkumar Ramanlal Gajjar, Managing Director - DIN: 05254111



### **REGIONAL OFFICE:**

1st Floor, City Telephone Exchange, BSNL Bhavan, Nr. Kuber Bhavan, Jail Road, Baroda-390 001

**POSSESSION NOTICE** (UNDER RULE 8(1) OF THE SARFAESI ACT 2002)

Whereas, the Authorized officer of the Central Bank of India, Ghadiyali Pole, Branch under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, and in exercise of powers conferred under Section 13 (2) and 13 (12) read with the Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued a Demand Notice Dated 04.05.2024 calling upon the borrower. Ms. Meghavi Solanki to repay the amount mentioned in the notice being Rs.8,51,501.55/- (Rupees Eight Lakhs Fifty One Thousand Five Hundred One & Fifty Five Paisa Only) plus interest and other expenses from 04.05.2024 to till date within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to pay the entire dues of the bank, notice is hereby given to the borrower, the Guarantor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under section 13 (4) of the said act, read with Rule 8 of the Security Interest (Enforcement) Rule 2002 on this 12 TH DAY OF JULY 2024

The borrower and the Guarantor in particular and the public in general is here by cautioned not to deal with the property and any dealing with the property will be subject to charge of Central Bank of India, for the amount of Rs. 8,51,501.55/- (Rupees Eight Lakhs Fifty One Thousand Five Hundred One & Fifty Five Paisa Only) plus interest and other expenses.

The borrowers attention is invited to provisions of sub section (8) of Section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

### DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that piece and parcel of The Immovable Property being Flat No.C-405, Having construction area adm.1650 Sq. Ft. S.B.A on 4th Floor of "TOWER-C" Godavari within scheme namely "AAMBAWADI SANGAM" which developed & organized on land adm.8800 Sq. Mtr, bearing Block/Survey No.132 (Old Block/Survey No. 114 before promulgation) and Block/Survey No.131 (Old Block/Survey No. 113 before promulgation) situated at Moje Village SANGAMA, Sub. Dist. of Padra and Dist. of Vadodara. Bounded: Towards East by: Leaving marginal space Tower-Yamuna, Towards West by: Pent House No. C-406. Towards North by: Passage, Towards South by: Adjoining survey number.

Date: 18.07.2024- Place: Baroda

Authorised Officer, Central Bank Of India

## આરોપી ૧૨થી ૧૫ ટકા લેખે વ્યાજ વસૂલતો હતો

# સુરતમાં વ્યાજખોરે ૨ લાખનું ૬.૮૩ લાખ વ્યાજ વસુલતાં ફરિયાદ થઇ • સુરત,તા.૧૯ ધમકી આપી હતી.ઉધના પોલીસે લાલી લાલીએ જમીન-દલાલ આશિ

સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરવાની સાથે તાલુકા મથકે સેમિનાર યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલીને ઉધના પોલીસે ઝડપ્યો હતો. તેનો તેના વિસ્તારમાં જ વરઘોડો કાઢીને તેની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી.પોલીસે તેની ઓફિસનું તાળું તોડીને એન્ટ્રી લીધી હતી તેમજ તેની સંપત્તિ અંગે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરને પણ જાણ કરાશે. લાલીએ અલથાણના બાદ વધુ ત્રણ લાખની માગણી કરી નહીં આપે તો જીવતો નહીં રહેવા દેવાની લેખે વ્યાજ વસૂલતો હતો.

કરતો હતો એ ઓફિસનાં તાળાંની ચાવી ન મળતાં ઓફિસના શટરનું તાળું હથોડા વડે તોડીને પ્રવેશ કર્યો હતો. ઓફિસની અંદર દસ્તાવેજ અને કાગળો લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસને જાણકારી મળી છે કે વ્યાજખોરી કરીને આરોપી લાલીએ કરોડો રૂપિયાની સંપત્તિ પણ બનાવી લીધી છે.

ઈંદ્રને સોંપવામાં આવશે. આ મામલે પ્રવેશ કરી શકે એમ નહોતું, કારણ કે તેની જમીન-દલાલને વ્યાજે આપેલા ૨ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે લાખની સામે ૬.૮૩ લાખ પડાવી લીધા ધર્મેન્દ્ર પાસે લાઇસન્સ છે જેનો દુરુપયોગ છે. લાલીએ પોતાની ઓફિસમાં ફેંસલોક કરીને તે વ્યાજે રૂપિયા ફેરવતો હતો. હતી. ૧૫ લાખની રકમનો ચેક લખાવી નિયમ પ્રમાણે દોઢ ટકા જ વ્યાજ વસૂલી કોર્ટમાં ખોટા કેસ કરવાની તેમજ રૂપિયા શકાય છે. પરંતુ આરોપી ૧૨થી ૧૫ ટકા તપાસ હવે ટૂંક સમયમાં ઉધના પોલીસ

લાલીએ જમીન-દલાલ આશિષ ગુજરાતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો જે ઓફિસમાં બેસીને વ્યાજખોરીનો ધંધો મુખીજા પાસેથી ૧૨ ટકા વ્યાજ સાથે નાણાં વસૂલી ઉપરથી ૧૫ લાખના ચેક લખાવી ધમકી આપી હતી. લાલી પર ભૂતકાળમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં વધુ ફરિયાદો દાખલ થાય એવી શક્ચતા છે. આ સિવાય પોલીસ લાલી અને તેના પરિવારના નામે જેટલી મિલકતો છે એની વિગતો મેળવીને ઇન્કમટેક્સ અને ઇડીને રિપોર્ટ કરશે. વ્યાજખોર ધર્મેન્દ્ર આ સંપત્તિની તપાસ ટૂંક સમયમાં ઉર્ફે લાલીની હાઈટેક ઓફિસમાં કોઈ ઓફિસ માત્ર તેના ચહેરાથી જ ખૂલી શકે રાખ્યું છે. પોલીસને લાલીની ઓફિસમાંથી અનેક ફાઈલો પણ મળી આવી છે, જેની દ્વારા કરવામાં આવશે.

# જખોના દરિયાકિનારેથી ડ્રગ્સના ૧૦ પેકેટ જપ્ત નેવીએ ફરી એકવાર નાકામ કર્યું તથાખોરોનું પડયંત્ર પરિણામે દરિયાઈ સીમા પર પણ સતર્કતા

વિદેશી તાકતોથી દેશને કાયમ ખતરો રહ્યો છે.પડોશી દેશ યુદ્ધમાં ભારતને હરાવી શકતા નથી તેથી ભારતને બરબાદ કરવા માટે થોડા થોડા દિવસો બાદ અવનવી યુક્તિ અજમાવી દેશની શાંતિ ભંગ કરવાની કોશિશ કરી રહયા છે. જેમાં આતંકવાદી પ્રવૃતિઓ, સેનાના જવાનો પર હુમલો હોય કે બીજી અન્ય કોઈ ઘટનાથી દેશની શાંતિ જોખમમાં મૂકવાના પ્રયત્નો

કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આ વિદેશી તાકતો એ દેશમાં નશાખોરીના પદાર્થો મોકલીને દેશના યુવાધનને ખરાબ કરવાની નાકામ કોશિશ કરી રહયા છે, આ નવી મોડસ ઓપરેન્ડી મારફતે હજી સુધી દેશની સમુદ્ર સીમાથી ગેરકાયદેસર ડ્રુગ્સના પકેટ મોકલવામાં આવી રહ્યા છે.

વધારી દેવામાં આવી છે.

એવામાં દેશની પશ્ચિમી સમુદ્ર સીમા પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. કચ્છના દરિયા કાંઠેથી ફરી એકવાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો યથાવત બન્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં હાલમાં જ BSFના જવાનને ફરી એકવાર અગાઉની જેમ બિનવારસી ડ્રગ્સના પેકેટ મળી આવતા તપાસનો દોર વધારી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ કચ્છના જખો નજીકના નિર્જન ટાપુ પરથી મ્જીકના જવાનને બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ૧૦ પેકેટ ડ્રગ્સ મળી આવતા દરિયાઈ સેના અલર્ટ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં સેનાને પેટ્રોલિંગથી ૧૯૨ બિનવારસી ડ્રગ્સના પકેટ મળી આમ હવે દેશની સમુદ્ર સીમા પર આવ્યા છે. તેથી સેના આ અંગે હવે વધુ જોખમમાં વધારો થઈ રહ્યો છે, જેને સતર્કતા રાખવામાં આવી રહી છે.

# ભચાઉ હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલ નીતા ચોધરી બુટલેગરની સાસરીમાંથી પકડાઈ ૪ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં ડીઆઇજી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે

હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે. ગુજરાત છ્જીની ટીમે નીતા ચૌધરીની લીમડીના એક ગામમાંથી ઝડપી પાડી છે. આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી. સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ

પોલીસની ટીમ નીતા ચોંધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી. પરંતુ, ઘર પર તાળું જોઇ પોલીસને ખાલી હાથે પરત ફરી હતી. ત્યાર બાદથી પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી હતી.

ભાવનગરની સરદાર પટેલ એજ્યુકેશન

ઈન્સ્ટિટ્યુટ સંચાલિત લાખાણી વિદ્યા સંકુલમાં

વીજપ્રવાહ બંધ થઈ જતા વિદ્યાર્થિનીઓ

બેભાન થઈ ગઈ. ભારે ઉકળાટ અને ગરમી

વચ્ચે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

હતી. જેથી સંચાલકોએ વિદ્યાર્થિનીઓના

વાલીઓને બોલાવ્યા હતા. જે બાદ વાલીઓ

વિદ્યાર્થિનીઓને હૉસ્પિટલ લઈ ગયા

હતા. એટલું જ નહીં વિદ્યાર્થિનીના વાલીનો

આક્ષેપ છે કે, મસમોટી ફ્રી લેતી શાળાઓ

વિદ્યાર્થીઓને પાયાની સુવિધા નથી આપી

રહી. અને વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

છતાં તેમની હૉસ્પિટલ તાત્કાલિક ન લઈ ગયા.

જ્યારે ઈન્સ્ટિટ્યુટના મેનેજમેન્ટે બચાવ કર્યો

કે, તેમણે વિદ્યાર્થિનીઓની પ્રાથમિક તપાસ

કરાવી હતી. આ મામલે શિક્ષણાધિકારીએ

મંજૂરી વગર માટી કાઢતા

ખાણખનીજ વિભાગનો સન

પેટ્રોકેમિકલ્સને છ કરોડનો દંડ

🌘 આણંદ,તા.૧७

પેટ્રોકેમિકલ્સને છ કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની

છેલ્લા દસ મહિનાથી મંજૂરી વગર વડગામના દરિયાઈ

અખાતમાંથી માટી કાઢતી હતી. આના લીધે તે સવાલ

ઉદભવે છે કે કંપની દસ મહિના સુધી આ રીતે માટી

ગુજરાતના ખાણખનીજ વિભાગે આણંદની સન

કચ્છમાં ભચાઉ ભચાઉ ચકચારી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. આ મામલે હાઈકોર્ટમાં આગોતરા ચૌધરી તેની સાથે પકડાયેલા બુટલેગરની જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે. જોકે, જામીન અરજી પર સુનાવણી થયા તે પહેલાં જ ગુજરાત મળતા એટીએસની ટીમે લીમડી ખાતેથી છ્જીની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ સોંપવામાં આવશે.કચ્છના ભચાઉમાં કરી છે. અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છૂપાઈ હતી.જો કે, ઉલ્લેખનીય છે કે, બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ ઉપર ગાડી ચડાવી હતી. તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઇને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા જો કે, પોલીસ ધરપકડ કરે તે પહેલાં મથકે ફરિયાદ નોંધાઈ હતી.એટીએસના કાર્યવાહી હાથ ધરી હતી.

શાળા સંચાલકોની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન બની હોવાનો વાલીઓનો આક્ષેપ

ભાવનગરની સરદાર પટેલ સ્કૂલમાં પાવર

કટ થતાં, બફારાંથી વિદ્યાર્થીનીઓ બેભાન

ભાવનગર શહેરના કાળીયાબીડ

વિસ્તારમાં આવેલી ખાનગી સરદાર પટેલ

એજ્યુકેશન ઇન્સ્ટિયુટ સંચાલિત લાખાણી

વિદ્યા સંકુલમાં આજે કોઈ કારણોસર

વીજપ્રવાહ બંધ થઈ ગયો હતો, ચોમાસુ ચાલતું

હોય ભારે ઉકળાટ અને ગરમી સહન નહિં

કરી શકતા અનેક વિદ્યાર્થીનીઓ બેભાન બની

ઢળી પડી હતી. જેથી સંચાલકો દ્વારા વિધાર્થની

ના વાલીઓ ને ફોન કરી બોલાવવામાં આવ્યા

હતા, જેથી વાલીઓ તાત્કાલિક હોસ્પિટલ

પહોંચતાં બેભાન બનેલી વિદ્યાર્થીનીઓ ને

તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જેમાં એક વિદ્યાર્થિનીને ખાનગી હોસ્પિટલ

આવશે.

કહ્યું કે, તેમની ટીમ તપાસ કરી રહી છે. જો 🛮 ખસેડવામાં આવી હતી. વિદ્યાર્થિનીના વાલી

કોઈનો વાંક જણાશે તો કાર્યવાહી કરવામાં દીપક પરમારે જણાવ્યું હતુંકે, લાખો રૂપિયાની

જામીન રિજેક્ટ થવાની જાણ હોવાથી નીતા સાસરી લીમડીમાં છુપાઈ ગઈ હતી. ગુજરાત એટીએસને આ અંગેની બાતમી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને પોલીસ પર કાર ચડાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. પરંતુ, નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે મંગળવારે જામીન રદ કરતા

## ટામેટા-બટાટા, લીંબુ સહિતનામાં ૬૦ થી ७૦ વધ્યા

# વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોની શાકભાજીની આવક ઘટી છે અને છૂટક માર્કેટમાં માંગ વધી છે. અત્યારે સુરત શાકભાજી માર્કેટમાં દરેક શાકભાજીના ભાવમાં ૬૦ થી ૭૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અચાનક શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. અને બેંગ્લોરથી પણ શાકભાજીની આવક ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનું બજેટ કહેવાઇ રહ્યુ છે કે, નવા પાકનો ઉતાર આવી રહી છે. જોકે, હવે નવા પાકનો પણ ખોરવાઇ ગયુ છે.

ગુજરાતમાં પડી રહેલા વરસાદથી છે. અચાનક શાકભાજીના ભાવ વધતા ગુ શકયતા છે.

સમાચાર સામે આવ્યો છે. હાલમાં સુરતમાં શાકભાજીના ભાવમાં ભડકો

જોવા મળ્યો છે. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં ધરખમ ૬૦થી ૭૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અત્યારે ટામેટા, બટાટાથી લઇને લીંબુ સહિતના

શાકભાજી પકવતા ખેડૂતો માટે મોટા હિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ છે.

સુરત શાકભાજી માર્કેટમાં અત્યારે ટામેટાં અને લીંબુના પ્રતિકીલોના ભાવ ૧૦૦ રૂપિયા નોંધાયો છે, તુવેર ૧૫૦ રૂપિયા, પાપડીના ભાવ ૧૮૦ રૂપિયા સુધી પ્રતિકીલોએ પહોંચ્યો છે. જ્યારે સુકુ લસણ પ્રતિકીલો ૨૪૦ રૂપિયાએ વેંચાઇ રહ્યું છે. સુરત છઁસ્ઝમાં નાસિક થયા બાદ ભાવમાં ઘટાડો થવાની શક્ચતા ઉતાર થયા બાદ ભાવમાં ઘટાડો થવાની

## અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી

# અનંત અને રાધિકા અંબાણી લગ્ન ભાદ જામનગર પહોંચ્યા

અંબાણીના લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંજ્ઞેના લગ્ન ખુબ જ શાહી સ્ટાઈલથી કરવામાં આવ્યા હતા. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.

લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિની જામનગરમાં એન્ટ્રી થઈ છે.જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા

૫૦થી વધુ મેડિકલ સ્ટોરના લાયસન્સ અંતે

१६ स्टाया

• રાજકોટ, તા.૧७

રાજકોટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રિસ્ક્રિપ્શન વિના દવા વેચનાર મેડિકલ સ્ટોર સંચાલકો પર તવાઈ બોલાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં શહેર, પ૪ મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.

રાજકોટ શહેર, જિલ્લામાં ગેરરીતિ આચરનાર સંચાલકો સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મળેલી બાતમીના આધારે અનેક મેડિકલ સ્ટોર પર તપાસ શરુ કરી હતી. જે પછી ગોંડલના હરસિધ્ધિ ફાર્મા, ક્રિષ્ના સર્જાટેક, લેજોરા ફોર્મ્યુલેશનના લાયસન્સ રદ કર્યા છે. તો નેપ્ચ્યુન ફાર્મા, સુરભી મેડિકલ સ્ટોર, પ્રગતિ મેડિકલ સ્ટોર સામે પણ તવાઈ હાથ ધરી છે.

આ સિવાય નશીલી સીરપ વેચનાર ર મેડિકલ સ્ટોર સંચાલકો સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. આ તમામ મેડિકલ સ્ટોર સંચાલકો કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વગર દવા વેચતા હોવાનું સામે આવ્યુ છે.

અંબાણી પરિવારના નાના દિકરા અનંત હતુ. રાધિકા અને અનંત જામનગર પહોંચતા કનેક્શન પણ કહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, જ આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું જામનગર તેની દાદીનું ઘર છે એટલે કે, હતુ. બંત્રે ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા. બાળપણમાં અનંત અંબાણી જામનગર આ બંન્નેને જોવા માટે હજારોની સંખ્યામાં રહેતો હતો. આટલા માટે તેને જામનગર ચાહકો જોવા મળ્યા હતા.

અનંત અંબાણીએ વનતારા શરુ કર્યું છે. આ લગ્ન ૧૨ જુલાઈના રોજ કરવામાં આવ્યા જામનગર મુંબઈમાં જાજરમાન શાનદાર સ્થળ પર અનંત અને રાધિકાનું પહેલી પ્રી વેડિંગ ફંકશન પણ રાખવામાં આવ્યું હતુ. જેમાં અનેક સ્ટાર જોવા મળ્યા રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. હતા આ સાથે સ્પોર્ટસ જગતની હસ્તીઓ, રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જિયો અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બિઝનેસ મેન, તેમજ વિદેશી નેતાઓ પણ વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા

કપલ મુંબઈ થી જામનગર રાત્રે પહોંચ્યું અનંતે જામનગરને પોતાના સાથે જોડાયેલું સાથે ખુબ પ્રેમ છે. તમને જણાવી દઈએ તમને જણાવી દઈએ કે, જામનગરમાં કે, અનેંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હતા. તેના એક દિવસ બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ

### જોવા મળ્યા હતા. આ આયોજન પહેલા હતા.

Looking for an Office Assistant Languages...compulsory Hindi English and Gujarati

Additional language will be beneficial MBA or MCom..Min age 30, having 5-6 years experience Good communication skills, with hands on Computer

Salary 25k, depending on experience.

Milestone Finance Consultancy Mob: 9904601444 1103 K10 Grand, Behind Atlantis Alkapuri Road, Near Genda Circle, Vadodara

Nikka Incorporated is Baroda based company since year 2000. Nikka is a sole distributor of ABB Field Instrumentation product portfolio. We are looking for young professionals for following positions.

Sales Engineer (Field Instrumentation) Candidate should be graduate with 1 to 5 years of experience in selling of products like

Pressure, Level, Flow and Temperature transmitters. He should be ready to travel across Vadodara and Bharuch districts. Service Engineer (Field Instrumentation)

Candidate should be graduate with 1 to 3 years of experience in after sales support of

products like Pressure, Level, Flow and Temperature transmitters. He should be ready to travel across Guiarat state Candidate must possess B.E/Diploma degree in Instrumentation & Control / Electronics / Electrical.

NOTICE is hereby given that the EXTRAORDINARY GENERAL MEETING of the Members of AJWA FUN WORLD AND RESORT LIMITED will be held on Friday, 09th Day of August, 2024 AT 04.00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM"), to transact the following

Email resume to milind.shah@nikkainc.com

Approval for Sale/Disposal of land of the Company pursuant to the provisions of Section 180(1)(a
of the Companies Act, 2013 and Regulation 37A(1) of the Securities and Exchange Board of India
(Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015:

(Listing Obligations And Disclosure Requirements) Regulations, 2015:

To consider and if thought fit, to pass the following Resolution as a Special Resolution: 
"RESOLVED THAT pursuant to the provisions of Section 180(1)(a) and other applicable provisions, if any, of the Companies Act, 2013 ("Act") read with Rules made thereunder (including any statutory modification or re-enactment thereof, for the time being in force), the enabling provisions of the Memorandum and Articles of Association of the Company and Regulation 37A(1) and ther applicable provisions of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and subject to such other approvals, consents and permissions obtained/to be obtained from the appropriate third parties including concerned statutory authorities and subject to such terms and conditions as may be imposed by them, and which may be agreed to by the Board of Directors of the Company, approval of the Members of the Company be and is hereby accorded to the Board of Directors of the Company (hereinafter referred as the "Board" which term shall be deemed to include any Committee which the Board may have constituted or hereinafter constitute from time to time to exercise its powers including the power conferred by this resolution), for effecting the sale, bifurcation, assignment, transfer and conveyance of the Property comprising of land owned by the company admeasuring 25,279 S.q. conveyance of the Property comprising of land owned by the company admeasuring 25,279 Sq Mtrsbearing CTS number NA 62 and land admeasuring 69,973 Sq Mtrs bearing CTS number NA 63 (P) situated at Village Rayantalawadi, Taluka Waghodia, District Baroda, India to G P Development Limited (hereinafter referred as the "Buyer") in one or more tranches/phases and either as a whole or in part for per square meter rate Rs. 5,968.37 and subject to such terms and conditions as mutually agreed upon by

he Company with the Buyer RESOLVED FURTHER THAT the Board be and is hereby authorized to do such further acts, deeds and things as may be necessary including modifying, finalizing the terms and conditions and executing all such agreements, undertakings, contracts, deeds and other documents on behalf of the Company, file sacri agreements, undertakings, contracts, deeds and other documents on belian of the Company, me applications and make representation in respect thereof and seek approval from statutory / administrative authorities, financial institutions / banks etc., in this regard as may be applicable and deal with any matters, take necessary steps in this matter as the Board may in its absolute discretion deem necessary, desirable and expedient to give effect to this resolution and to settle any question / difficulty that may arise in this regard and incidental thereto, without being required to seek any further consent or approval of the Members or otherwise to the end and intent that the Members shall be deemed to have given their approval thereto expressly by the authority of this resolution.

RESOLVED FURTHER THAT the Board be and is hereby authorised to delegate all or any of the power.

herein conferred, to any Committee of Directors or Director(s) / Manager / Chief Financial Officer & Chief Risk Officer / Company Secretary and/or any of the officers / authorised representatives of the Company, with authorities as required, affixing the Common Seal of the Company on agreement/documents, arranging delivery and execution of Contract, deeds, agreements and instruments." and instruments."
BY ORDER OF BOARD OF DIRECTORS
For, AJWA FUNWORLD AND RESORTS LTD

Date: 16-07-2024

RAJESHKUMAR CHUNILAL JAIN

# રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ગંભીર આરોપ SIT મુખ્ય આરોપીને બચાવી રહી છે : ઇન્દ્રનીલ રાજયગુરૂ

ગુજરાતનો સૌથો મોટા લોકમેળાને લઈને

તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. લોકો પણ આ લોકમેળામાં આવવા આતુર છે. આ લોકમેળામાં આ વખતે ટીઆરપી અગ્નિકાંડમાં સરકારની રહેલી ખામીઓ દર્શાવતો સ્ટોલ જોવા મળે તો નવાઈ નહીં. કોંગ્રેસ દ્વારા સરકારની ખામીઓને ઉજાગર કરતો સ્ટોલ નાખવાની તૈયારીઓ દર્શાવી છે. આ અંગે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી પણ માગવામાં આવશે.જો જિલ્લા વહીવટી તંત્ર કોંગ્રેસને મંજૂરી આપશે તો કોંગ્રેસ સરકારની ખામીઓ ઉજાગર કરતો સ્ટોલ લોક મેળામાં નાખશે.

રાજકોટમાં આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં કોંગ્રેસી નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે''લોક મેળામાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ અંગે લોકોની જાગૃતતા માટે સ્ટોલની માંગ કરીશું. જો સરકાર લોકમેળામાં પોતાની વાહવાહીના સ્ટોલ મુકતા હોય છે તો અમારો પણ TRP ગેમ ઝોનના પિડીતોના ન્યાય માટેની માંગ સૌથી મોટો સવાલ એ છે કે શું જિલ્લા આવી ચૂક્યું છે.

વહીવટી તંત્ર આવી કોઈ મંજૂરી આપશે? કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમ અંગે પણ કહ્યું હતું કે તેઓ આગામી સમયમાં પણ વિરોધ કરશે.

TRP ગેમ ઝોનની લઇને ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એમ ડી સાગઠિયાની ધરપકડ કરીને SIT મુખ્ય આરોપીને બચાવી રહી છે. સાગઠિયા પકડાયો છે પરંતુ મુખ્ય આરોપી હજુ બહાર છે. લાંચ લેનાર અંદર છે,લાંચ આપનાર હજુ બહાર છે. સાગઠિયાએ પદાધિકારીઓના નામ આપ્યા છે. રૂપાપરાનું નામ આપ્યું છે પરંતુ સરકાર કોઇ એક્શન લેતી નથી.

સરકાર આ કાંડમાં અનેક લોકોને છાવરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે સરકાર પર પણ આક્ષેપો કર્યા હતા. જ્યારથી રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બની છે ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજકોટના કરતો સ્ટોલ મૂકવો અમારો હક છે.× પરંતુ પૂર્વ ધારાસભ્યનું નામ પણ અગાઉ ચર્ચામાં

# ત્રણ ગોડાઉનમાંથી ૬૦૦ બોરી અનાજનો જથ્થો મળ્યો કડીમાં GIDC માંથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવ્યો

• મહેસાણા, તા.૧७

<u>અનાજનો જથ્થો ગોડાઉનમાં ભરવામાં લઈ તપાસ શરુ કરવામાં આવી છે.</u>

આવેલો હોવાને લઈ સ્થાનિક પોલીસના મહેસાણા જિલ્લામાંથી શંકાસ્દ અધિકારીઓ દ્વારા દરોડો પાડવામાં અનાજનો જથ્થો ઝડપાયો છે. પોલીસ આવ્યો હતો.મોટા પ્રમાણમાં ઘઉં અને દ્વારા બાતમી આધારે દરોડો પાડવામાં ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. આવ્યો હતો અને તેને જપ્ત કરવામાં આ જથ્થાને મિક્સ કરીને અલગ પેકિંગ આવ્યો છે. કડી જીઆઈડીસીમાં શંકાસ્પદ તૈયાર કરવામાં આવતા હોવાની આશંકા ને 🛭 તે સવાલ પણ ઊભો

કાઢતી રહી તો ખાણ અને ખનીજ વિભાગ શું કરતો હતો. આટલા સમય પછી કેમ કાર્યવાહી કરવામાં આવી. આટલા સમય સુધી કેમ કોઈ પગલાં ન લેવાયા તેવા અનેક સવાલ ઉદભવે છે.દિલીપ સંઘવીની કંપનીને દંડ કરવામાં આવ્યો તેની સાથે તે સવાલ પણ ઉદભવ્યો છે કે જિલ્લા વહીવટીતંત્રએ દસ મહિના સુધી કેમ આ બાબતની કોઈ સુધ લીધી નહીં. રાજ્યના પર્યાવરણ વિભાગ અને

ખાણખનીજ વિભાગની મંજૂરી વગર કોઈપણ કંપની ગમે ત્યારે તેની મરજી<sub>ા</sub> મુજબ આ રીતે માટી કેવી રીતે કાઢી શકે

### અને ને વિદ્યાર્થીનીઓ ને સિવિલ હોસ્પિટલ પશ્ચિમ રેલવે-વડોદરા ડિવિઝન

ભારતના રાષ્ટ્રપતિ વતી અને તેમના માટે ડિવિઝનલ રેલવે મેનેજર (ઇલેક્ટ્રિકલ ટીઆરડી), પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, વડોદરા -390004 દ્વારા નીચે જણાવેલ કામ માટે ટેન્ડર આમંત્રિત છે. **અ.નં.** 1 ટેન્ડર નં.: EL/TRD/Tender/24-25/09 પરિધિમાં 25 KVA સહાયક ટ્રાન્સફોર્મર અને કેબલિંગ પ્રવૃત્તિની જોગવાઈ. કામનો અંદાજીત (રુ.માં): ₹ 55,400/- ટેન્ડર ડોક્યુમેન્ટ્સની કિંમત અને પૂર્ણ કરવાનો સમયગાળો: પણ કરવાનો સમયગાળો-09મહિના, **ટેન્ડરનું શિડ્યુલ**: ટેન્ડર બંધ થવાની તારીખ અને સમય: ત 13/08/2024 ના રોજ 15.00 કલાકે. **વેબપેજની** વિગત અને નોટિસ બોર્ડનું સ્થળ જ્ય ટેન્ડરની સંપૂર્ણ વિગત જોઈ શકાશે. અને **માહિતી માટે ઓફિસનું સરનામું:** વેબસાઈટ **@** www.ireps.gov.in ડિવિઝનલ રેલવે મેનેજ (ઇલેકિટ્રકલ ટીઆરડી), પશ્ચિમ રેલવે

અमने साध5 5रोः 🕂 facebook.com/WesternRly

બની ગઈ હતી. પરંતુ બેભાન થયેલી વિદ્યાર્થિનીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાના બદલે શાળા સંચાલકો દ્વારા તેઓના વાલીઓ ને બોલાવી વિદ્યાર્થીનીઓ ને તેમના હવાલે કરી હતી. વાલીઓ દ્વારા શાળા સંચાલકો દ્વારા બેદરકારી આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.ભાવનગર જિલ્લાના ડી.ઈ.ઓ. હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતુંકે, સવારથી આખા વિસ્તારમાં લાઈટ ના હોવાના કારણે બે વિદ્યાર્થીનીઓ ને મૂંઝવણ થઈ હોવાનું સામે આવ્યું છે. પશ્ચિમ રેલવે – વડોદરા ડિવિઝન

ફી વસૂલતી શાળાઓ દારા વીજપ્રવાહ બંધ

થતાં જનરેટર ની કોઈ વ્યવસ્થા કરવામાં

આવી ના હોય અસહ્ય બફારો સહન નહિ

કરી શકવાના કારણે વિદ્યાર્થીનીઓ બેભાન

### <u>ઓપન ઇ-ટેન્ડર નોટિસ</u> ટેન્ડર નં. EL/TRD/Tender/24-25/09

ખર્ચ **(રુ.માં): ₹** 27,71,380/- **બિડ સિક્યોરિટી** પ્રતાપનગર, વડોદરા -390 004

### EOT ક્રેન નું રીકન્ડિશનિંગ કાર્ય ઈ-ટેન્ડર નોટિસ ∶ M.137\_MEC\_PRTN

「END\_23\_12R ભારતના રાષ્ટ્રપતિ અને તેમન ાતી, ચીફ વર્કશોપ મેનેજર, કેરેજ અને વેગન રેપેર વર્કશોપ, પશ્ચિમ રેલવે, પ્રતાપનગર, નીરં ાપેલ વિગતો મુજબ ઈ-ટેન્ડર આમંત્રિત કરે છે ામનું નામ : પ્રતાપનગર ફેક્ટરીમાં EOT ક્રેન ક્ષમતા 15/5 ટન) નું રીકન્ડિશનિંગ કામ. (મેક વા ઈન્જીનીયરીંગ ઈન્ડસ્ટ્રીઝ) **કામની અંદાજિ**ત કેંમત : ₹991200/- બિડ સિક્યોરિટીર્ન ડિપોઝિટ : ₹19800/- ટેન્ડર દસ્તાવેજ ફી : શુન્ય કાર્ય પૂર્ણ સમયગાળો : 03 મહિના ઓફરર્ન ાન્યતા : 90 દિવસની <mark>ટેન્ડર જમા કરવાની અને</mark> ાોલવાની તારીખ અને સમય : બિડિંગ 12-08 2024 ના રોજ 15.00 કલાકે બંધ થશે અને જ દિવસે 15.30 કલાકે ખોલવામાં આવશે પ્રસાઇટ સરનામું / સ્થળ જ્યાં સંપૂર્ણ માહિર્ત **જોઈ શકાશે :** ચીફ ફેક્ટરી મેનેજરની ઓકિસ ાતાપનગર પશ્ચિમ રેલવે - 380004 વેબસાઈટ

સ્થળ : વકોદરા

### સ્ટાચરેનિક્સ પરફોર્મન્સ મટેરીચલ્સ લિમિટેડ

(અગાઉ ઇનીઓસ સ્ટાયરોલ્યુશન ઇન્ડિયા લિમિટેડ તરીકે જાણીતી) CIN: L25200GJ1973PLC002436

**૨૭૨૨ર્ડ ઓફિસ :** ૯મો માળ, " શિવા " ્સારાભાઇ કોમ્પ્લેક્ષ, ડૉ. વિક્રમ સારાભાઇ માર્ગ, વડીવાડી, વડોદરા - ૩૯૦ ૦૨૩, ગુજરાત. होन: +६१ २९५ २३०३२०१ / २३०३२०२

E mail: secshare@styrenix.com | Website: www.styrenix.com

વિડીઓ કોન્ફરેન્સિંગ (વીસી) / અન્ય ઓડિયો વિઝુઅલ માધ્યમો (ઓએવીએમ) દ્ધારા આચોજિત ૫૧મી વાર્ષિક સાધારણ સભા. કંપનીના શેરહોલ્ડરોએ નોંધ લેવી કે ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ)

દ્ભારા જારી સામાન્ય પરિપત્ર નંબરો ૨૦/૨૦૨૦ અને ૧૦/૨૦૨૨, અનુક્રમે તારીખ ૦૫ મે, ૨૦૨૦, ૨૮, કિસેમ્બર, ૨૦૨૨ અને ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ તથા સિકયુરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા જારી લાગુ પડતા પરિપત્રો અને અન્ય લાગુ પડતા બઘાજ કાયદા અને પરિપત્રોના અનુપાલન સ્વરૂપ કેંપનીની પશ્મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ) મિટિંગની નોટિસમાં દર્શાવેલ કામકાજ કરવા માટે **બુધવાર, ૨૧મી ઓગષ્ટ, ૨૦૨૪ ના રોજ ભારતીય સમય અનુસાર સવારે ૧૧.૩૦ વાગ્યાથી** વિકિયો કોન્ફરન્સિંગ (વીસી)/અન્ય ઓડિયો વિઝુઅલ માધ્યમોં (ઓએવીએમ) દ્વારા યોજાશે.

- ઉકત પરિપત્રો અંતર્ગત એજીએમની નોટિસની ઇકલેકટ્રોનિક કોપીઓ અને વાર્ષિક અદેવાલ ૨૦૨૩-૨૦૨૪ કંપની / ડીપોઝિટરી સદભાગી(ઓ) પાસે જેમનાં ઇ-મેઇલ સરનામાં નોંધાચેલાં છે તે બધા શેરહોલ્ડરોને મોકલવામાં આવશે.

- ડીમટીરિચલાઈઝડ માધ્યમમાં શેરો ધરાવતા શેરહોલ્ડરો અને જેમનાં ઈ-મેઈલ સરનામાંની નોંઘણી થઈ નથી તેમને તેમનાં ઈ-મેઈલ સરનામાં અને મોબાઈલ નંબરો તેમની કિપોઝિટરી સહભાગીઓ દ્વારા તેમની સંબંધિત કિપોઝિટરીઓ પાસે નોંધવી દેવા વિનંતી છે.

- ભેોતિક સ્વરૂપમાં શેરો ધરાવતા શેરહોલ્ડરોને તેમના હોલ્ડિંગ્સ ડિમેટ કરવાની અથવા તેમના ઈ-મેઈલ સરનામાં અને મોબાઈલ નંબરો અને કિવીકન્ક મેળવવા માટે બેંકની વિગતો ઇન્વેસ્ટર સર્વિસ રીક્વેસ્ટ ફોર્મ્સ (ISR-1 અને ISR-2) ભરીને કંપનીના રજિસ્ટ્રાર એન્ડ શેર ટ્રાન્સફર એજન્ટ, લીંક ઇનટાઇમ ઇન્ડિયા પ્રા. લિમિટેડ ને મોકલી આપવા વિનંતી છે. ઉપરોક્ત ફોર્મ્સ કંપનીની વેબસાઇટ <u>www.styrenix.com</u> અને આરટીએ ની વેબસાઇટ https://liiplweb.linkintime.co.in/KYC-downloads.html પર ઉપલબ્ધ છે.

- ડીમટીરિયલાઈઝડ માધ્યમમાં શેરો ધરાવતા શેરહોલ્ડરોએ ડિવીડન્ડ મેળવવા માટે તેમનાં બેંક/ઇસીએસ ની વિગતો તેમની ડિપોઝિટરી સદભાગીઓ દ્વારા તેમની સંબંધિત ડિપોઝિટરીઓ પાસે નોંધાવી દેવા વિનંતી છે.

શેરહોલ્ડરોને ઇલેકટ્રોનિક વોર્ટિંગ સિસ્ટમ દ્વારા એજીએમની નોટિસમાં આપ્યા મુજબના રીઝોલ્યુશનના વિષયો પર એજીએમ પહેલાં અથવા એજીએમ દરમ્યાન, તેમના મત આપવાની તક મળશે. ડીમટીરિયલાઇઝડ સ્વરૂપ તથા ભૌતિક સ્વરૂપમાં શેરો ધરાવતા શેર હોલ્ડરો અને જેમનાં ઇમેઇલ સરનામાં નોંઘાયા નથી, તેવા શેરहોલ્કરો માટે દૂરથી અથવા એજીએમ દરમ્યાન મતદાન આપવાની પદ્ધતિ શેરહોલ્ડરો માટેની નોટિસમાં આપવામાં આવશે.

પ૧મી એજીએમની નોટિસ અને વાર્ષિક અદેવાલ ૨૦૨૩-૨૦૨૪, કંપનીની વેબસાઇટ www.styrenix.com પર, શેરબજારોની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com અને એનએસડીએલ ની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ

શેરહોલ્ડરો કૃપા કરીને નોંધ લે કે, ઉકત ઉલ્લેખિત પરિપત્રોને ધ્યાનમાં લેતાં કંપની, એજીએમની નોટિસની અને વાર્ષિક અહેવાલની નકલો શેરહોલ્ડરોને ભૌતિક સ્વરૂપમાં મોકલાવશે નહીં.

સ્ટાયરેનિક્સ પરફોર્મન્સ મટેરીયલ્સ લિમિટેડ માટે

સહી/-તારીખ: ૧૭ જુલાઇ, ૨૦૨૪ ચિંતન દોશી મેનેજર લીગલ એન્ડ કંપની સેક્રેટરી

### **INTEGRA ENGINEERING INDIA LIMITED** CIN: L29199GJ1981PLC028741

INTEGR/

ENGINEERING Regd. Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat Tel. No.: +91 90999 18471.

**Email ID**: info@integraengineering.in **Website**: www.integraengineering.in Statement of Unaudited Standalone Financial Results for the Quarter ended 30th June. 2024

Jiaic	otatement of officialities of anticipated interesting for the Quarter effices of in June, 2027				
	(₹ in Lacs)				
Sr. No.	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023		
1	Total income from operations	3,556.86	3,843.34		
2	Net Profit / (Loss) for the period before Tax	422.14	597.22		
3	Net Profit / (Loss) for the period after Tax	293.63	417.64		
4	Total Comprehensive Income for the period	295.02	417.33		
5	Equity Share Capital	343.65	343.65		
6	Other Equity				
7	Earnings per share of ₹ 1/- each				
	(1) Basic	0.85	1,21		
i l	(2) Diluted	0.85	1.21		

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in and on Stock Exchange website (www.bseindia.com).

Place : Mumbai Date: 17.07.2024

Place : Mumbai

Date: 17.07.2024

For INTEGRA Engineering India Limited Shalin Sunandan Divatia **Independent Director** 

# INTEGR∧

ENGINEERING Regd. Office: Chandrapura Village, Tal. Halol-389 350, Dist. Panchmahals, Gujarat. **Tel. No. :** +91 90999 18471.

Email ID: info@integraengineering.in Website: www.integraengineering.in

State	Statement of Unaudited Consolidated Financial Results for the Quarter ended 30th June, 2024			
	(₹ in Lac			
Sr. No.	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023	
1	Total income from operations	3,556.86	3,843.34	
2	Net Profit / (Loss) for the period before Tax	422.14	597.22	
3	Net Profit / (Loss) for the period after Tax	293.63	417.64	
4	Total Comprehensive Income for the period	295.02	417.33	
5	Equity Share Capital	343.65	343.65	
6	Other Equity			
7	Earnings per share of ₹ 1/- each			
	(1) Basic	0.85	1.21	

Notes: 1. The above is an extract of the detailed format of Quarterly / Year ended Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Year ended Financial Results are available on the Company's website (www.integraengineering.in

> For INTEGRA Engineering India Limited Shalin Sunandan Divatia Independent Director

### **INTEGRA ENGINEERING INDIA LIMITED** CIN: L29199GJ1981PLC028741

	(₹ in La			
Sr No	Particulars	Quarter ended 30.06.2024	Quarter ended 30.06.2023	
1	Total income from operations	3,556.86	3,843.34	
2	Net Profit / (Loss) for the period before Tax	422.14	597.22	
3	Net Profit / (Loss) for the period after Tax	293.63	417.64	
4	Total Comprehensive Income for the period	295.02	417.33	
5	Equity Share Capital	343.65	343.65	
6	Other Equity			
7	Earnings per share of ₹ 1/- each			
	(1) Basic	0.85	1.21	
	(2) Diluted	0.85	1,21	

and on Stock Exchange website (www.bseindia.com).